



UPL Limited, UPL House
610 B/2, Bandra Village
Off Western Express Highway
Bandra (East), Mumbai 400 051, India

w: upl-ltd.com
e: contact@upl-ltd.com
t: +91 22 7152 8000

15th July 2022

BSE Limited
Mumbai

National Stock Exchange of India Ltd
Mumbai

SCRIP CODE: 51207

SYMBOL: UPL

Sub: Newspaper advertisement – Information regarding 38th Annual General Meeting and other related information.

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, we enclose herewith copies of the public notice of the 38th Annual General Meeting and other related information, published today i.e. 15th July, 2022 in the following newspapers:

1. Financial Express - All Editions (English)
2. Western Times - Ahmedabad (Gujarati)

We request you to take the above information on records.

Thanking you,

Yours faithfully,
For **UPL Limited**

**Sandeep Deshmukh
Company Secretary &
Compliance Officer
(ACS-10946)**

Encl.: As above



UPL Limited

CIN: L24219GJ1985PLC025132

Regd. Office: 3 -11, G.I.D.C., Vapi, Valsad-396195, Gujarat
Telephone: +91 260 2432716 | Email: upl.investors@upl-ltd.com | Website: www.upl-ltd.com

INFORMATION REGARDING 38TH ANNUAL GENERAL MEETING AND NOTICE OF BOOK CLOSURE

- The thirty-eight Annual General Meeting ("AGM") of the Company will be held through Video Conferencing/Other Audio-Visual Means ("VC facility") on **Friday, August 12, 2022 at 12.30 p.m. (IST)**, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), read with the General Circulars/Notifications issued by the Ministry of Corporate Affairs ("MCA") and SEBI (collectively referred to as "applicable circulars"), to transact the business set out in the Notice convening the AGM. Members will be able to attend and vote at the AGM through VC facility. Alternatively, Members can view the live webcast of AGM by visiting the link <https://www.evoting.nsdl.com>. Members participating through the VC facility only shall be deemed to be present at the AGM and their presence shall be reckoned for the purpose of quorum.
- In compliance with the applicable circulars, the Notice convening the AGM and the standalone and consolidated financial statements for the financial year 2021-22, along with Board's Report, Auditors' Report and other documents required to be attached thereto, will be sent to all the Members of the Company whose email addresses are registered with the Company/ Depository Participant(s). The aforesaid documents will also be available on the Company's website at www.upl-ltd.com and on the website of the Stock Exchanges, i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of NSDL at <https://www.evoting.nsdl.com>.
- Manner of registering /updating KYC details including email addresses by Members:**
 - Members holding shares in physical mode, who have not registered/updated their KYC details including email addresses with the Company, are requested to register/update the same by writing to the Company with details of folio number and attaching a self-attested copy of PAN card at upl.investors@upl-ltd.com or to Link Intime India Private Limited at rnt.helpdesk@linkintime.co.in.
 - Members holding shares in dematerialised mode, who have not registered/updated their email addresses with their Depository Participants, are requested to register/update their email addresses with the Depository Participants with whom they maintain their demat account.
- Manner of casting vote(s) through e-voting:**
 - Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ("e-voting").
 - The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialised mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of AGM.
 - The facility for voting through electronic voting system will also be made available at the AGM and Members attending the AGM through VC facility who have not cast their vote(s) by remote e-voting and are otherwise not barred from doing so shall be eligible to vote through e-voting system in the AGM.
 - The login credentials for casting votes through e-voting shall be made available to the members through email. Members who do not receive email or whose email addresses are not registered with the Company/RTA/Depository Participant(s), may generate login credentials by following instructions given in the 'Notes' forming part of the Notice convening the AGM.
 - The login credentials as aforesaid may also be used for attending the AGM through VC facility.
- Dividend:**
 - The Board of Directors has recommended a dividend of Rs.10/- per equity share at their meeting held on May 09, 2022. The **Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, July 29, 2022 to Friday, August 12, 2022 (both days inclusive)** for determining entitlement of Members to dividend, recommended by the Board of Directors of the Company for the financial year ended March 31, 2022.
 - Subject to approval of Members at the AGM, the dividend will be paid to the Members whose names appear on the Company's Register of Members as on **Thursday, July 28, 2022**, and in respect of the shares held in dematerialised mode, to the Members whose names are furnished by National Securities Depository Limited and Central Depository Services (India) Limited as beneficial owners as on **Thursday, July 28, 2022**.
 - As per the applicable circulars, payment of dividend shall be made through electronic mode to the members who have updated their bank account details. Dividend warrants/ demand drafts will be dispatched to the registered address of the members who have not updated their bank account details.
 - Payment of dividend will be subject to deduction of tax at source (TDS) at applicable rate. For more details, please refer to the 'Notes' forming part of the Notice convening the AGM and our email dated June 30, 2022 sent to the Members.
 - Members are requested to consider this as a Notice pursuant to section 91 of the Companies Act, 2013.
- Manner of registering mandate for receiving Dividend:**
Members are requested to register/update their complete bank details:
 - With their Depository Participant(s) with whom they maintain their demat accounts, if shares are held in dematerialised mode by submitting the requisite documents and
 - With the Company/LinkIntime India Private Limited by emailing at upl.investors@upl-ltd.com or rnt.helpdesk@linkintime.co.in, if shares are held in physical mode, by submitting (i) scanned copy of the signed request letter which shall contain member's name, folio number, bank details (Bank account number, Bank and Branch Name and address, IFSC, MICR details), (ii) self-attested copy of the PAN card and (iii) cancelled cheque leaf.
- Members are requested to read and understand all the Notes forming part of the Notice convening the AGM particularly those dealing with manner of casting vote through remote e-voting or e-voting during the AGM.

For UPL Limited
sd/-

Sandeep Deshmukh

Company Secretary & Compliance Officer

Place: Mumbai

Date: July 14, 2022



યુપીએલ લિમિટેડ

CIN:L24219GJ1985PLC025132

રજિ.ઓફિસ: ૩-૧૧, જી.આઈ.ડી.સી., વાપી, જિ-વલસાડ, ગુજરાત-૩૮૬ ૧૮૫.

ટેલીફોન નં.+૯૧ ૨૬૦ ૨૪૩૨૭૧૬, ઈમેલ: upl.investors@upl-ltd.com વેબસાઈટ: www.upl-ltd.com

૩૮મી વાર્ષિક સામાન્ય મીટીંગ અને બુક બંધ કરવા અંગેની સુચના ની માહિતી

૧. આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ૩૮મી એન્યુઅલ જનરલ મીટીંગ (“એજીએમ”) શુક્રવાર, ૧૨મી, ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) વિડીયો કોન્ફરન્સિંગ/ અન્ય વિઝ્યુઅલ મીન્સ (“વીસી”) દ્વારા લેવામાં આવશે. કંપની અધિનિયમ, ૨૦૧૩ અને તેના હેઠળના નિયમો અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રીકવાયરમેન્ટ્સ)ના નિયમો, ૨૦૧૫ (સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન)ના પાલન સાથે, અને મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ (એમસીએ) દ્વારા રજૂ કરાયેલા અન્ય લાગુ પરિપત્રો અને સેબી (સામૂહિક રૂપે લાગુ પરિપત્રો તરીકે ઓળખાય છે), જે એજીએમ બોલાવવાની સૂચનામાં જણાવેલા કાર્યો પાર પાડવા માટે સભ્યો વીસી દ્વારા એજીએમ પર હાજરી આપીને મતદાન કરી શકશે. વૈકલ્પિક રીતે, સભ્યો <https://www.evoting.nsdl.com> પર લિંક દ્વારા એજીએમનું લાઈવ વેબકાસ્ટ જોઈ શકે છે. વીસી સુવિધા દ્વારા ભાગ લેનારા સભ્યોને ફક્ત એજીએમ ખાતે હાજર હોવાનું માનવામાં આવશે અને તેમની હાજરી કોરમના હેતુ માટે ગણવામાં આવશે.
૨. લાગુ પડેલા પરિપત્રોના પાલનમાં એજીએમની નોટીસ અને સ્ટેન્ડલોન અને કન્સોલિડેટેડ નાણાકીય નિવેદનો, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે બોલાવેલી નોટિસ સાથે બોર્ડનો રિપોર્ટ, ઓડિટર્સ રિપોર્ટ અને તેમાં જોડાયેલા અન્ય દસ્તાવેજો મોકલવામાં આવશે. કંપનીના બધા સભ્યો કે જેમના ઈમેઈલ સરનામાં કંપની / ડિપોઝિટરી સહભાગી (ઓ) સાથે નોંધાયેલા છે. ઉપરોક્ત દસ્તાવેજો કંપનીની વેબસાઈટ www.upl-ltd.com પર અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ પર, એટલે કે બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ www.bseindia.com પર અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ રહેશે. અનુક્રમે, અને એનએસડીએલની વેબસાઈટ પર <https://www.evoting.nsdl.com>.
૩. સભ્યો દ્વારા ઇમેઈલ સરનામાંઓ નોંધણી / અપડેટ કરવાની રીત:
 - એ) ફીઝીકલ સ્થિતિમાં શેર ધરાવતા સભ્યો, જેમણે કંપની સાથે તેમના ઈમેઈલ સરનામાંની નોંધણી / સુધારા કર્યા નથી, તેઓને ફોલીયો નંબરની વિગતો સાથે કંપનીને લખીને નોંધણી / સુધારા કરવા અને પાનકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ જોડવા વિનંતી છે, જે તે upl.investors@upl-ltd.com પર અથવા rnt.helpdesk@linkintime.co.in પર લીંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને મોકલી શકે છે.
 - બી) ડિમીરિયલાઈઝ્ડ મોડમાં શેર ધરાવતા સભ્યો, જેમણે તેમના ડિપોઝિટરી સહભાગીઓ સાથે તેમના ઈમેઈલ સરનામાંઓ નોંધણી / સુધારા કર્યા નથી, તેઓને ડિપોઝિટરી સહભાગીઓ સાથે તેમના ઈમેઈલ સરનામાંની નોંધણી / સુધારા કરવા વિનંતી કરવામાં આવે છે, જેમની સાથે તેઓ પોતાનું ડિમેટ એકાઉન્ટ જાળવે છે.
૪. ઈ-મતદાન દ્વારા મતદાન કરવાની રીત:
 - એ) સભ્યોને એજીએમની સૂચનામાં ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી (ઈ-વોટિંગ) દ્વારા સૂચવેલા કામકાજ પર પોતાનો મત (ઓ) આપવાની તક મળશે.
 - બી) ડિમીરિયલાઈઝ્ડ મોડ, ફીઝીકલ સ્થિતિમાં શેર ધરાવતા સભ્યો દ્વારા રિમોટલી મતદાન કરવાની રીત (રીમોટ ઈ-વોટિંગ) અને જે સભ્યોએ તેમના ઈમેઈલ સરનામાં નોંધાવેલ નથી તેમને એજીએમની સૂચનામાં આપવામાં આવશે.
 - સી) ઈલેક્ટ્રોનિક મતદાન પ્રણાલી દ્વારા મતદાન માટેની સુવિધા વીસી દ્વારા એજીએમમાં હાજર રહેલા સભ્યોને પણ ઉપલબ્ધ કરવામાં આવશે, પરંતુ જેમણે રિમોટ ઈ-મતદાન દ્વારા પોતાનો મત આપ્યો નથી તે એજીએમ પર મત આપી શકશે.
 - ડી) ઈ-મતદાન દ્વારા મતદાન કરવા માટેના લોગિન ઓળખપત્રો ઈમેઈલ દ્વારા સભ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે સભ્યો પાસે ઈમેઈલ સુવિધા નથી અથવા જેમના ઈમેઈલ સરનામાં કંપની / આરટીએ / ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે નોંધાયેલા નથી, તેઓ એજીએમની સૂચનાના ભાગની નોંધમાં આપેલા સૂચનોને અનુસરીને લોગઈન કરવા માટે માન્યતા પ્રાપ્ત કરી શકે છે.
 - ઈ) ઉપરોક્ત તરીકે લોગઈન માન્યતાનો ઉપયોગ વીસી દ્વારા એજીએમમાં ભાગ લેવા માટે પણ થઈ શકે છે.
૫. ડિવિડન્ડ:
 - એ) બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૮મી મે ૨૦૨૨ના રોજ મળેલી બેઠકમાં શેર દીઠ રૂ. ૧૦/- ના ડિવિડન્ડની ભલામણ કરી છે. જે ૩૧મી માર્ચ, ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ભલામણ કરેલ, ડિવિડન્ડના સભ્યોના હક નક્કી કરવા માટે. કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુકસ શુક્રવાર, ૨૬મી જુલાઈ ૨૦૨૨ થી શુક્રવાર, ૧૨મી ઓગસ્ટ ૨૦૨૨ (બંને દિવસો સહિત) બંધ રહેશે.
 - બી) એજીએમ દ્વારા સભ્યોની મંજૂરીને આધિન, ડિવિડન્ડ એવા સભ્યોને ચૂકવવામાં આવશે, જેમના નામ કંપનીના રજિસ્ટર પર ગુરુવાર, ૨૮મી જુલાઈ, ૨૦૨૨ ના રોજ, અને ડિમીરિયલાઈઝ્ડ મોડમાં રાખેલા શેરના સંદર્ભમાં, સભ્યોને આપવામાં આવશે. જેના નામ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા તારીખ ગુરુવાર, ૨૮મી જુલાઈ, ૨૦૨૨ ના રોજ સુધી લાભદાયક માલિકો તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.
 - સી) લાગુ પરિપત્રો મુજબ ડિવિડન્ડની ચૂકવણી ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા એવા સભ્યોને કરવામાં આવશે કે જેમણે તેમના બેંક ખાતાની વિગતોમાં જરૂરી સુધારો કર્યો છે. ડિવિડન્ડ વોરન્ટ્સ/ ડિમાન્ડ ડ્રાફ્ટ એવા સભ્યોના રજિસ્ટર્ડ સરનામાં પર મોકલવામાં આવશે કે જેમણે તેમના બેંક ખાતાની વિગતોમાં સુધારો કર્યો નથી.
 - ડી) ડિવિડન્ડની ચૂકવણી લાગુ દરે સ્રોત પર કર (ટીડીએસ)ની કપાતને આધીન રહેશે. વધુ વિગતો માટે, કૃપા કરીને એજીએમની સૂચનામાં જણાવેલ નોંધના સંદર્ભ અનુસાર, અને સભ્યોને ૩૦મી જૂન, ૨૦૨૨ના રોજ ઈમેઈલ દ્વારા ડિવિડન્ડ અને ટીડીએસ માટેની માહિતી મોકલવામાં આવી છે.
 - ઈ) સભ્યોને કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૮૧ અનુસાર આ સૂચના ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવે છે.
૬. ડિવિડન્ડ મેળવવા માટે નોંધણીની વ્યવસ્થા
 - એ) સભ્યોને તેમની બેંક ખાતાની વિગતોમાં નોંધણી / સુધારા કરવા વિનંતી છે:
 - એ) તેમના ડિપોઝિટરી સહભાગી (ઓ) ની સાથે કે જેમની સાથે તેઓ તેમના ડિમેટ ખાતાઓનું સંચાલન કરે છે, જો શેર જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને ડિમીરિયલાઈઝ્ડ મોડમાં રાખવામાં આવે છે અને
 - બી) upl.investors@upl-ltd.com અથવા rnt.helpdesk@linkintime.co.in પર ઈમેઈલ કરીને કંપની / લિંક્સ ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે, જો શેર ફીઝીકલ સ્થિતિમાં હોય તો, દસ્તાવેજોમાં (i) સહી કરેલ વિનંતી પત્ર જેમાં, સભ્યનું નામ, ફોલિયો નંબર, બેંક વિગતો (બેંક એકાઉન્ટ નંબર, બેંક અને શાખાનું નામ અને સરનામું, આઈએફએસસી, માયકર કોડની વિગતો), (ii) પાનકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ અને (iii) રદ કરેલા ચેકની નકલ, સ્કેન દ્વારા અપલોડ કરવા.
૭. સભ્યોને એજીએમ બોલાવવાની નોટિસના ભાગ રૂપે નોંધાયેલ તમામ નોંધો વાંચવા અને સમજવા વિનંતી છે, ખાસ કરીને જેઓ રિમોટ ઈ-વોટિંગ દ્વારા અથવા એજીએમ દરમિયાન મતદાન કરવાની રીતનો વ્યવહાર કરે છે.

યુપીએલ લિમિટેડ વતી,

સહિ

સંદીપ દેશમુખ

(કંપની સેક્રેટરી અને કંપલાયન્સ ઓફિસર)

મુંબઈ

૧૪મી જુલાઈ, ૨૦૨૨